

અરજીની તા. :

મળ્યા તા. :

Form Fee Rs. 30.00

હાલનો સેવિંગ્સ / કરન્ટ /

કેશકેડીટ / ટર્મલોન / વાહન લોન ખાતા નં.

એમ. એસ. કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, વડોદરા.

હે. ઓ. તથા નિઝામપુરા શાખા : એમ. એસ. પ્લાઝા, અભિલાષા ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ,
વડોદરા ૨૪. ફોન : ૨૭૪૧૩૪૩૩, ૨૭૧૩૪૩૪, ૨૭૧૩૪૩૫

શાખા :

કલીન કેશકેડીટ / હાથ. કેશકેડીટ / ઓવરડ્રાફ્ટ / સ્થાવર મિલ્કત - ટર્મ લોન / હાઉસીંગ લોન / વાહન /
મશીનરી ઈક્વીપમેન્ટ તથા અન્ય ઘર વપરાશનાં સાધનો માટેની ધીરાણ અરજી

કલા. આઈ.ડી. : કલા. આઈ.ડી. : કલા. આઈ.ડી. :

વ્યક્તિ / પેઢી / કંપનીનું નામ :

જન્મ તારીખ : પાન નંબર :

સરનામું (ઓફીસ) :

(રહેઠાણ) :

માતાનું નામ :

(જો અરજદાર ભાગીદારી પેઢી /
કંપની હોય તો તેના મુખ્ય ભાગીદાર /
મુખ્ય ડીરેક્ટરના ઘરનું સરનામું આપવું.)

ટેલીફોન નંબર : ઓ. : ફેક્ટરી : રહે. :

મોબાઈલ નંબર : ધારકનું નામ લખવું

ઈ-મેલ આઈ.ડી. :

લઘુમતી હોય તો : હા / ના... (મુસ્લીમ, શીખ, ઈસાઈ, પારસી, બુદ્ધીષ્ટ, જૈન, વિકલાંગ, અનુ જાતિ, અનુ જનજાતિ)

ધંધો / નોકરીની સંપૂર્ણ વિગત :

પેઢીનું બંધારણ :

અરજદાર / પેઢી / કંપનીની : રૂ. તારીખ ના રોજ

હાલની ચોખ્ખી મૂડી

કુટુંબના અન્ય સભ્યોની : ઘરના સભ્યનું નામ અરજદાર સાથેનો સંબંધ વાર્ષિક આવક રૂ.

વાર્ષિક આવક (જેમણે વ્યક્તિગત રીતે

લોન અરજી આપી હોય તેમણે અવશ્ય

દર્શાવવી.) અરજી સાથે આવકની દાખલાની

કોપી સામેલ કરવી.

અરજદાર એક કરતાં
વધારે હોય તો તેમજ
જામીનદારોના ફોટા
એપ્લિકેશન ફોર્મના
પાન નંબર ૬ ઉપર
ચોટાડવા.

અ. નં.	વ્યક્તિગત અરજદાર/પેઢીના માલિક/ભાગીદાર/કંપનીના ડાયરેક્ટર્સના આખા નામ, પાન કાર્ડ નંબર	ઉંમર	રહેઠાણનું સંપૂર્ણ સરનામું લેન્ડમાર્ક, પીનકોડ, ફોન નંબર સાથેનું	ચોખ્ખી મૂડી તા. ના રોજ	વાર્ષિક આવક	સભાસદ નંબર
૧						
૨						
૩						
૪						
૫						
૬						

જામીનદારની વિગત :

અ. નં.	જામીનદારનાં પૂરાપૂરા નામ, પાનકાર્ડ નં.	ઉંમર	ઘરનું સરનામું, પીનકોડ નં., ફોન નંબર સાથે	નોકરી/ઘંઘાનું સરનામું, પીનકોડ, ફોન નંબર સાથે	વાર્ષિક આવક	સભાસદ નંબર
૧						
૨						
૩						

અરજદારના હાલના બેન્કર્સનું નામ તથા ખાતાના પ્રકારની વિગત :

બેન્કનું નામ તથા શાખાનું નામ	ખાતાનો પ્રકાર તેના નંબર સાથે	હાલમાં કોઈપણ પ્રકારના ધીરાણની સવલતનો ઉપયોગ કરતા હોય તે તેની વિગત

પ્રતિ,
મેનેજરશ્રી,
એમ.એસ. કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ

શાખા, વડોદરા.

હું / અમો નીચે સહી કરનાર (અરજદારનું નામ)

આપની બેન્કમાં નીચે દર્શાવેલ વિગતે કરજ મેળવવા અરજી કરું છું / કરીએ છીએ. અને તે અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. આ માટે બેન્કના વખતો વખત અમલમાં આવતા ધારાધોરણો, પેટા કાયદા, ધીરાણના નિયમો તેમજ શરતો મને / અમોને કબૂલ મંજૂર છે / રહેશે.

ધીરાણનો પ્રકાર	જો હાલ ધીરાણ ચાલુ હોય તો તેની બાકી પડતી રકમ આ કોલમમાં દર્શાવવી		નવા / વધારાના ધીરાણની માંગણી રૂ.	વધારાની ધીરાણ સાથેની કુલ ધીરાણની માંગેલ રકમ રૂ.
	મંજૂર થયેલ લિમિટ રકમ રૂ.	આજની તારીખે બાકી પડતી રકમ રૂ.		
૧) ટર્મ લોન અ) મશીનરી / ઈક્વીપમેન્ટ માટે બ) માલિકીની સ્થાવર મિલકત સામે ક) ઓફીસ / દુકાન ખરીદવા માટે				
૨) હાઉસિંગ લોન મકાન બાંધવા / ખરીદવા / રીપેરીંગ માટે				
૩) વાહન ખરીદવા માટે				
૪) ઘર વપરાશનાં સાધનો ખરીદવા માટે				
૫) કેશક્રેડિટ - હાઇપોથેકેશન ઓફ ગુડ્સ / સ્ટોક / બુક-ડેબ્ટ્સ (ઉધરાણી)				
૬) કલીન કેશક્રેડિટ / ઓવરડ્રાફ્ટ (સ્થાવર મિલકત / અન્ય ટેન્જિબલ સિક્યુરીટીની સામે)				
૭) બીલ્સ પરચેઝ / ડિસ્કાઉન્ટ માન્ય બેન્કની એલ.સી.ની સામે				
૮) અન્ય ધીરાણની સવલતો માટે જેવી કે				

નોંધ : ધીરાણ / લોનની રકમ જે હેતુ માટે લેવાની હોય તેની વિગત (બેન્ક દ્વારા ધિરાણના નાણાં કયાં વપરાયા તેની માહિતી) :

ટર્મલોન / ડીમાન્ડ લોન ધીરાણની મુદત : ૧૨ / ૨૪ / ૩૬ / ૪૮ / ૬૦ /

માસ માટે

લોન પરત કરવાના હતાની વિગત : _____ એક સરખા માસિક હતાથી _____ વર્ષની અંદર _____ માસના મોરેટોરિયમ પિરિયડ સાથે જેમાં પ્રથમ હમો તથા વ્યાજ સાથે રૂ. _____ નો તા. _____ ના રોજ ભરવાની બાંહેધરી આપીએ છીએ અને છેલ્લો હમો રૂ. _____ નો _____ તારીખના રોજ અથવા તે પહેલાં ભરપાઈ કરવાની ખાતરી આપું છું / આપીએ છીએ.

ટર્મલોન માટેના પ્રોજેક્ટની વિગત :

(અ) જો ધીરાણ મશીનરી / ઇક્વીપમેન્ટ / વાહન / ઘરગથ્થુ સાધનો ખરીદવા / લેવાનું હોય તો :

મશીનરી / ઇક્વીપમેન્ટ / વાહન / ઘરગથ્થુ સાધનોની વિગત	ખરીદ કિંમત બીલ / ક્વોટેશન પ્રમાણે	જેની પાસેથી ખરીદવાના હોય તે સપ્લાયર / ઓથોરાઈઝ્ડ ડીલર / ડિસ્ટ્રીબ્યુટર્સના નામ તથા સરનામા

(બ) ધીરાણ જો મકાન / ઓફીસ / દુકાન બાંધવા / ખરીદવા / રીપેરીંગ માટે લેવાનું હોય તો તેની વિગત :

૧) મકાન બાંધવાનું / ખરીદવાનું હોય તે વેચનાર બિલ્ડર્સ અથવા સ્થાવર મિલ્કત વેચનારનું નામ તથા સરનામું ટેલીફોન નંબર સાથે :

૨) ધીરાણથી જે મકાન બાંધવાનું / ખરીદવાનું હોય તેનું અથવા જે સ્થાવર મિલ્કત ખરીદવાની હોય તે જગ્યાનું સરનામું, સર્વે નં., ટીકા નં., સેન્સસ નં. :

૩) સ્થાવર મિલ્કતની ખરીદ કિંમત / બાંધકામ / રીપેરીંગનો ખર્ચ રૂ. _____

૪) સ્થાવર મિલ્કતની બાંધકામની વિગત :

પ્લોટનું ક્ષેત્રફળ _____ ચો. ફૂટ

ભોયતળીયાનું બાંધકામ _____ ચો. ફૂટ પહેલા માળનું બાંધકામ _____ ચો. ફૂટ

બીજા માળનું બાંધકામ _____ ચો. ફૂટ કુલ બાંધકામ _____ ચો. ફૂટ

અથવા જો દુકાન / ફ્લેટ / ઓફીસ હોય તો તેનો બિલ્ટઅપ એરીયા / કારપેટ એરીયા _____ ચો. ફૂટ

પેઢી / કંપનીની					(રૂપિયા લાખમાં)
ફાયનાન્સીયલ વિગતો /	૩૧/૦૩/૨૦	૩૧/૦૩/૨૦	૩૧/૦૩/૨૦	૩૧/૦૩/૨૦	૩૧/૦૩/૨૦
એક્યુઅલ / પ્રોજેક્ટેડ	(એક્યુઅલ)	(એક્યુઅલ)	(પ્રોવિઝનલ)	(પ્રોજેક્ટેડ)	(પ્રોજેક્ટેડ)

વેચાણ

ચોખ્ખો નફો

ચોખ્ખી મૂડી તથા રોકાણ

અનસિક્યોર્ડ લોન / ડિપોઝીટ
મિત્રો / સગા સંબંધી પાસેથી
લીધેલી રકમની વિગત

સિક્યોર્ડ લોન / બેન્ક તથા
અન્ય ફાઇનાન્સીયલ સંસ્થા
પાસેથી લીધેલી રકમની વિગત

માલ સ્ટોક

માલની સામે દેવું (ક્રેડિટર ફોર સ્ટોક)

ઉધરાણી

એકરારનામું : તારીખ _____ ની સરવૈયા મુજબ અમારી ફર્મ / પેઢી એ ચૂકવવા પાત્ર સ્ટેટ્યુટરી ડ્યુઝ ચુકવી દીધુ છે. અને આજની તારીખે કોઈપણ પ્રકારનું સ્ટેટ્યુટરી ડ્યુઝ ચૂકવવાનું બાકી નથી, તેની ખાત્રી આપીએ છીએ અથવા આજની તારીખે સ્ટેટ્યુટરી ડ્યુઝ પેટે રૂ. _____ ચૂકવવાના બાકી છે.

આથી હું / અમો અમારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે બેન્કને તારણમાં આપનાર મિલકતના અને લાગુ પડતા તમામ કાયદાકીય ચુકવણી પુરેપુરી કરેલ છે અને આજની તારીખે કોઈ કરવેરા બાકી નથી.

તારણમાં આપવાની વધારાની સ્થાવર મિલકત વિગત :

અ. નં.	સ્થાવર મિલકતની જગ્યાનું સરનામું તથા અન્ય વિગત સર્વે નંબર, પ્લોટ નં. સાથે	મૂળ ખરીદ કિંમત	હાલની બજાર કિંમત	માલિકી અને ટાઈટલ ધરાવનારનું નામ

અરજદાર પેઢી / કંપની હોય તો :

વેટ / સેલેક્શન નં. _____

લઘુ ઉદ્યોગ (SSI) એકમ નંબર _____ અન્ય રજિસ્ટ્રેશન (નોંધણી) નંબર _____

ચાલુ વર્ષનું અપેક્ષિત વેચાણ રૂા. _____ તારીખ _____

આથી જાહેર કરું છું/કરીએ છીએ કે આ અરજીમાં દર્શાવેલ અને જાહેર કરેલ તમામ વિગતો સંપૂર્ણપણે સાચી છે. બેન્કના ધારા ધોરણો, નિયમો મેં/અમોએ કાળજીપૂર્વક વાંચ્યા છે અથવા બેન્ક તરફથી મને/અમોને વાંચી સંભળાવવામાં આવ્યા છે. તદ્દુપરાંત ભવિષ્યમાં બેન્ક દ્વારા કરવામાં આવનાર તમામ સુધારા-વધારા/નિયમોમાં ફેરફાર મને/અમને પેઢી/કંપનીને બંધનકર્તા રહેશે તેની હું/અમો બાંહેધરી આપીએ છીએ. બેન્કની પરવાનગી વગર ભવિષ્યમાં હું/અમો બીજી લોન/ખાતું અન્ય બેન્ક/ફાઇનાન્સીયલ સંસ્થામાં નહીં ખોલાવીએ જેની ખાતરી આપું છું/આપીએ છીએ.

હું/અમે બેન્કના નિયમોનો ભંગ કરીએ/કસૂરવાર ઠરીએ તેમજ ધીરાણ પરત કરવામાં નિષ્ફળ નિવડીએ તો બેન્ક મારી/અમારી/પેઢીની તથા તેના માલિક/ભાગીદારોની માલિકીની સ્થાવર, જંગમ મિલ્કત વેચીને બાકી પડતી રકમ વ્યાજ તથા લીગલ ખર્ચ સહિત વસૂલ કરી લેવા હક્કદાર છે. તેમ છતાં બેન્કના વ્યવસ્થાપક મંડળને યોગ્ય લાગે ત્યારે મને/અમોને આપવામાં આવેલ ધીરાણ ગમે ત્યારે વસૂલ કરવા / બંધ કરવા બેન્ક હક્કદાર છે.

હું/અમો બેન્કના કોઈ ડાયરેક્ટર કે એક્ઝીક્યુટીવના સગા સંબંધી નથી. હું/અમો આથી બેન્કને સીબીલ/ક્રેડિટ એજન્સી/આર.બી.આઈ./અન્ય ગવર્નમેન્ટ એજન્સી/અન્ય બેન્ક વેગેરેને મારા/અમારા ખાતાને લગતી અથવા મારી/અમારી વિગતો જરૂર પડે ત્યારે આપવા મંજૂરી આપીએ છીએ.

અરજદારનાં પૂરેપૂરાં નામ	સભાસદ નંબર	સહી (નમુના પ્રમાણે કરવી)

અમે અરજદાર ખાત્રી આપીએ છીએ કે અમારી ફર્મના બંધારણમાં કોઈપણ જાતનો ફેરફાર થયો નથી અને ભવિષ્યમાં કોઈ ફેરફાર થશે તો બેન્કને તરત જ લેખિત જાણ કરીશું. વધુમાં અમારી ધીરાણ સવલતમાં જે જામીનદારોની જામીનગીરી આપી છે તે ચાલુ રાખશો અથવા અગાઉ જે જામીનદાર

આપ્યા હતા તેમાં હાલના જામીનદાર શ્રી / શ્રીમતી _____ ની જગ્યાએ નવા

જામીનદાર શ્રી / શ્રીમતી _____ ની જામીનગીરી આપીએ છીએ તે મંજૂર રાખશો.

જામીનદારના આખાં નામ	સભાસદ નંબર	સહી (નમુના પ્રમાણે કરવી)

અમો જામીનદાર ખાત્રી આપીએ છીએ કે જ્યાં સુધી ધીરાણ ભરપાઈ ના થાય ત્યાં સુધી અમારી જામીનદાર તરીકેની જવાબદારી ચાલુ રહેશે અને ધીરાણ બેન્કના નિયમ મુજબ ભરપાઈ ના થાય તો બેન્ક કોઈપણ જામીનદાર પાસેથી અલગ અલગ અથવા સંયુક્તપણે બધા જામીનદાર પાસેથી લેણી રકમ વ્યાજ સાથે વસૂલ કરવાને હક્કદાર છે. બેન્ક અમારા થાપણ ખાતા તથા વધારાના શેરમાંથી પણ લેણી રકમ વસૂલ કરવાની હક્કદાર રહેશે.

સ્થળ : વડોદરા. તારીખ : _____

નામ :

નામ :

નામ :

નામ :

અરજી સાથે સામેલ કરવાની વિગત / પેપરો :

અ) પ્રોપરાઈટરી / પાર્ટનરશીપ પેઢી / કેશકેડીટ / ઓવરડ્રાફ્ટ / ટર્મલોન ધીરાણની સવલત લેવા માંગતી હોય ત્યારે :

- પ્રોપરાઈટર / બધાજ પાર્ટનર તથા બધાજ જામીનદારોના પાસપોર્ટ સાઈઝ ફોટો એપ્લીકેશન ફોર્મમાં ચોટાડવા જરૂરી છે. અને જે તે ફોટા નીચે જે વ્યક્તિનો ફોટો હોય તેનું પુરેપુરું નામ લખવું જરૂરી છે.
- પેઢીનું ગુમાસ્તાધારા લાયસન્સ અથવા પેઢીની નોંધણીનું પ્રમાણપત્ર તથા નોટરાઈઝ કરેલ ભાગીદારી ફોર્મની નકલ વગેરે.
- છેલ્લા ત્રણ વર્ષના વેપાર ખાતુ (સરવૈયુ) નક્કી નુકસાન ખાતુ તેના શિડ્યુલ સાથે પાર્ટનર / પ્રોપરાઈટરની સહી કરેલું રજુ કરવું. છેલ્લા વર્ષની ઇન્કમેટેક્સ રિટર્નની કોપી, વેટ ભર્યાની ચલણની કોપી, છેલ્લા મહીનાનું સ્ટોક સ્ટેટમેન્ટ, પેઢીનું ૯૦ દિવસની ઉઘરાણીનું લીસ્ટ રજુ કરવું.
- ફર્મના પાન કાર્ડની કોપી અથવા પ્રોપરાઈટર / બધા જ પાર્ટનરના પાન કાર્ડની કોપી તથા એડ્રેસ પ્રુફ.
- ફર્મ અન્ય બેન્કમાં કેશકેડીટ અથવા કરંટ ખાતુ ધરાવતી હોય તો તેના છેલ્લા ૧૨ માસના સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટની કોપી.
- અન્ય બેન્કમાં ધીરાણ સવલત હોય તો તેની વિગત એપ્લીકેશન ફોર્મમાં અચૂક જણાવવી.
- ફર્મના પ્રોપરાઈટર / પાર્ટનર્સ તથા તેમના જામીનદારોની આવક તથા માલિકીના સ્થાવર મિલ્કત અંગે તેના દાખલા રજૂ કરવાના રહેશે.
- ફર્મ જે જગ્યાએ કાર્યરત હોય તે ઓફીસ / શેડની માલિકી અંગેના દાખલા અથવા જો ભાડે / લીઝ ઉપર હોય તો તેના પુરાવા રૂપે જે ડોક્યુમેન્ટ્સ હોય તેની કોપી રજૂ કરવાની રહેશે.
- ટર્મલોનના કેસમાં જે મશીનરી / સાધનો ખરીદવાના હોય તેનું ક્વોટેશન તથા જો ટર્મલોન મકાન / ફેક્ટરી શેડ / ઓફીસ માટે લેવાની હોય તો મકાનના એપ્રુવડ કરેલા નકશા / પ્લાન / એસ્ટીમેટ / દસ્તાવેજની કોપી અથવા સેલ એગ્રીમેન્ટ (બાનાખત)ની કોપી તથા સ્થાવર મિલ્કતને લગતા અન્ય જરૂરી દસ્તાવેજો રેવન્યુ રેકૉર્ડ / પત્રો રજૂ કરવાના રહેશે.
- અન્ય બેન્કમાં ધીરાણની સવલત જેવી કે કેશકેડીટ / ટર્મલોન / હાઉસીંગ લોન ચાલુ હોય તો જે તે બેન્કનું NOC / નોડ્યુ સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે.
- અરજદાર ફર્મના પ્રોપરાઈટર / પાર્ટનર્સ તથા જામીનદારો બેન્કના સભાસદ હોવા જોઈએ તથા જામીનદારો અરજદારની નજદીકના સગાં હોવા જોઈએ નહીં તેમજ અરજદાર અને જામીનદાર, કોસ ગેરેન્ટી માન્ય રાખવામાં આવશે નહીં.

બ) અરજદાર વ્યક્તિગત રીતે ટર્મલોન / મકાન / ઘરગથ્થુ સાધનો / વાહન ખરીદવા ધીરાણ લેવા માંગતા હોય ત્યારે :

- બાનાખત / વેચાણ દસ્તાવેજ / ઇન્ડેક્સ / નોંધણી ફી ની પાવતી વગેરે.
- મકાન / સોસાયટી લે આઉટ પ્લાનની પ્રમાણિત નકલ, કમ્પ્લીશન / ઓક્યુપેશન સર્ટીફિકેટ.
- એસ્ટીમેટની કોપી, મહાનગરની રજા ચિઠ્ઠીની નકલ.
- સોસાયટીની મિલ્કત ખરીદવાની હોય તો સોસાયટીના નોંધણી પ્રમાણપત્રની નકલની કોપી.
- સોસાયટીએ આપેલ અસલ શેર સર્ટીફિકેટ.
- સોસાયટીનો એલોટમેન્ટ લેટર, સભ્ય તરીકે સોસાયટીએ દાખલ કરેલ ઠરાવની નકલ.
- સોસાયટીનું એન.ઓ.સી., નોડ્યુ સર્ટીફિકેટ તથા સોસાયટીનો બાંહેધરી લેટર જેમાં દર્શાવેલ હોય કે બેન્કનો બોજો સોસાયટીના દફતરે નોંધાયેલ અને બેન્કની લેખિત પરવાનગી વગર સોસાયટી મિલ્કત તબદીલ કરશે નહીં.
- મિલ્કતને લગતા અન્ય રેવન્યુ રેકૉર્ડ જેવા કે પ્રોપર્ટી કાર્ડ, ૮ અ, ૭/૧૨ તથા ગામ નં. ૬ની નકલ, એન.એ. પરમીશન સનદ વગેરે.
- ઘરગથ્થુ સાધનો ખરીદવા હોય તો તેના ક્વોટેશન.
- વાહન ખરીદવું હોય તો તેનું ક્વોટેશન.
- ડ્રાઇવિંગ લાયસન્સની કોપી / રોડ પરમીટ / બેજ વગેરે.

સૂચના : ૧. અરજી ફોર્મ ઉપર અરજદાર તથા જામીનદારોએ ફોટો લગાડવો જરૂરી છે. ૨. અરજદારના રહેઠાણના પુરાવા માટે મકાન વેરા પાવતી / રેશનકાર્ડની કોપી / લાઈટબીલની કોપી. ૩. અરજદાર તથા જામીનદારની મિલ્કતની તથા આવકની વિગત બેન્કે નક્કી કરેલ શાખ ફોર્મમાં રજૂ કરવી અને તે અંગેના પુરાવા રજૂ કરવા. ૪. જામીનદારની જવાબદારી કરજદાર જેટલી જ રહેશે. ૫. અધૂરી વિગતવાળું તથા અન્ય પુરાવા રજૂ કરતા કાગળો વગરનું અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં. ૬. હાઉસીંગ લોન તથા સ્થાવર મિલ્કત ટર્મલોનના ખાતામાં ધીરાણ જો ૧૨ માસ પહેલા ચૂકવે ભરપાઈ કરવામાં આવશે તો દંડનીય વ્યાજ ૩% લેખે વસૂલવામાં આવશે.

દફતરની હકીકત

	શેરની સંખ્યા	જામીન થયા હોય તો તેમના નામ	લોનનો પ્રકાર	બાકી રૂા.
કરજદાર				
જામીનદાર (૧)				
જામીનદાર (૨)				

એમ. એસ. કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, વડોદરા.

હે. ઓ. : એમ. એસ. પ્લાઝા, અભિલાષા ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ, વડોદરા ૨૪. ફોન : ૨૭૪૧૩૪૩૩, ૨૭૧૩૪૩૪, ૨૭૧૩૪૩૫

બ્રાન્ચ / શાખાનું અવલોકન / ભલામણ

અરજદાર / પેઢી / કંપની :

ઘીરાણનો પ્રકાર :

ખાતા નંબર જો હોય તો :

શાખાનું નામ :

ઉપરોક્ત અરજદાર તરફથી નવી લોન અરજી / હાલની લોન ઉપરાંત બીજી લોન / કેશક્રેડીટ ખાતાની વધારાની લિમીટ માટે રીન્યુઅલ અરજી મળેલ છે. જે અંગે અમારો અભિપ્રાય / અવલોકન / ભલામણ નીચે મુજબ છે.

૧. કેશક્રેડીટ / ઓવરડ્રાફ્ટ ધીરાણના ઓપરેટીવ આંકડાઓ

(રકમ રૂ. માં)

૧/૪/૨૦

થી ૩૧/૩/૨૦

૧/૪/૨૦

થી ૩૧/૩/૨૦

લિમીટ

બેન્કે મેળવેલ વ્યાજની રકમ

એવરેજ આઉટસ્ટેન્ડિંગ

કેબીટ બેલેન્સ

ખાતાનું ટર્નઓવર

આજની તારીખે બાકી પડતી રકમ

વર્ષ દરમિયાન ખાતામાં બેલેન્સ નહીં હોવાથી રીટર્ન થેચલ ચેકની સંખ્યા _____ કુલ રૂપિયા _____

પ્રથમ ધીરાણ મંજૂરીની તારીખ : _____

છેલ્લે ધીરાણ રીન્યુ થયાની તારીખ : _____

ડોક્યુમેન્ટ્સ એક્ઝીક્યુટ થયાની તારીખ : _____

૨. લોન અરજી / રીન્યુઅલ અરજીની ચકાસણી દરમિયાન નીચે પ્રમાણેની ત્રુટીઓ ધ્યાન ઉપર આવી છે એની નોંધ લેવા વિનંતી.

૩. આજની તારીખે અરજદાર વ્યક્તિ / કર્મ નીચેની વિગતે ધીરાણ / લોનની સગવડનો ઉપયોગ કરે છે તેની વિગત નીચે મુજબ છે :

અ. નં.	ધીરાણનો પ્રકાર	ખાતા નંબર	ધીરાણ મંજૂર કર્યા તારીખ	લિમીટ	બાકી પડતી રકમ	મુદતવીતી રકમ
૧						
૨						
૩						

૪. ઉપર દર્શાવેલ ધીરાણની સામે અરજદાર / પેઢીએ નીચેની વિગતની મુખ્ય / સંલગ્ન સિક્યોરીટી તારણમાં આપી છે.

- I) સ્થાવર મિલ્કતનું સાદુ / ઇક્વિટીબલ મોર્ગેજ રૂા._____નું બેન્કની તરફેણમાં તા._____રોજ કરાવ્યું છે.
સદર સ્થાવર મિલ્કતનું બેન્કના વેલ્યુઅર શ્રી_____
તારીખ_____ના વેલ્યુએશન રીપોર્ટ મુજબ કિંમત રૂા._____થાય છે.
- II) LIC ની પોલીસી અથવા બેન્કની એફ.ડી.આર., જેની વિગત નીચે મુજબ છે.
LIC ની પોલીસી નંગ_____કુલ રૂા._____ની જેની તા._____ના રોજ સરન્ડર વેલ્યુ રૂા._____થાય છે.
બેન્કની એફ.ડી.આર. નંગ_____કુલ કિંમત રૂા._____થાય છે.

૫. શાખા મેનેજર / ઓફીસર / ઇન્ચાર્જ મેનેજરના ધીરાણ ખાતા અંગેના અવલોકન અભિપ્રાય / ભલામણ :

લોન કમીટીને / બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ઉપરોક્ત ત્રુટીઓની પૂર્તતા થયા બાદ ધીરાણ મંજૂર કરવા / ના મંજૂર કરવા ભલામણ છે.

સ્થળ : વડોદરા.

તારીખ :

શાખા મેનેજર

શાખા

હેડ ઓફીસનું અવલોકન / ભલામણ

અરજદાર / પેઢી / કંપની

ની ક્લીન કેશકેડીટ / કેશકેડીટ સ્ટોક, બુક ડેબ્ટ્સ / સ્થાયર મિલ્કત ટર્મલોન / હાઉસીંગ લોન / વાહન / મશીનરી-ઇક્વીપમેન્ટ ટર્મલોન / ઘર વપરાશના સાધનોની લોન માટેની અરજી તપાસી છે જે અંગેનો અભિપ્રાય / અવલોકન નીચે મુજબ છે. ધીરાણ / ધીરાણ રીન્યુઅલ (વધારાની લિમીટ સાથે) અરજીની ચકાસણી દરમિયાન નીચે જણાવેલ ત્રુટીઓ ધ્યાન ઉપર આવી છે. સદર ત્રુટીઓની પૂર્તતા થયા બાદ અને શાખાની

ભલામણને આધારે

ના

હેતુભાટેનું ધીરાણ રૂા. (રૂપિયા) લોન કમીટીને / બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નીચે જણાવેલ સિક્યોરીટી ડોક્યુમેન્ટ્સ તથા નિયમોની પૂર્તતાની શરતોએ ધીરાણ મંજૂર કરવા ભલામણ છે.

અવલોકન / ત્રુટીઓ :

- I. Nature of Loan : _____
- II. Purpose of Loan : _____
- III. Limit Sanctioned : _____
- IV. Security Margin / Cash Margin : _____ %
- V. Interest Rate : _____ % (per annum)

VI. Repayment Period and Repayment Schedule :-

VII. Security Documents :-

- a) D. P. Note to be signed by the Borrower and Guarantors.
- b) Letter of continuing security.
- c) Cash Credit Karajkhat / Karajkhat
- d) Composite Hypothecation Agreement for Hypothecation of

- e) General form of Guarantee to be Signed by the Guarantors.

- f) Counter Indemnity Bond on Stamp Paper (In case of Bank's guarantee.)

_____ standing in the name of
 _____ (Applicant / Proprietor / Guarantor / Director)

- h) Blank T.T.O. form to be signed by the Borrower (incase of vehicle loan)

VIII. Others Terms & Conditions :-

- a) In case of mortgage of immovable property, Title clearance report to be obtained from our Banks advocate.
- b) Valuation report from Bank's approved valuer to be obtained.
- c) In case of Vehicle loan our Bank's name to be registered as financier with RTO Authority and copy of such lien certificate / RTO book to be obtained.
- d) In case of all type of Loan / Cash credit acc. ant, A comprehensive Insurance of principal security as well as collateral security to be obtained by the bank and policy of the same duly assigned in favour of bank to be obtained.
- e) In case of Term Loan for vehicle and other machineries / equipments original money receipt and invoice to be obtained.
- f) In case of Housing loan / immovable property term loan, required papers/documents viz. Original sale deed, Registration slip, Index and other copy of paper as listed in title clearance report to be obtained.
- g) Direct payment of loan amount to authorized dealer of vehicle, machinery, equipment, and vendor of house / immovable property to be made.
- h) Pre / Post sanction inspection to be carried-out.

Note : The security documents and other terms & condition (applicable) have been tick-out for compliance before disbursement of Loan.

લોન / શાખ કમિટી

૧. _____ ૨. _____

૩. _____ ૪. _____

૫. _____ ૬. _____

ધીરાણ સમિતિ દ્વારા મુકવામાં આવેલ ઉપરોક્ત અરજી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગમાં તા. _____ ના રોજ ચર્ચા માટે લેવામાં

આવી અને સદરહું અરજી રૂા. _____ અંકે રૂપિયા _____

_____ પુરાની

ઠરાવ ક્રમાંક નં. _____ થી મંજૂર કરવામાં આવે છે.

સ્થળ : વડોદરા.

તારીખ :

મેનેજિંગ ડિરેક્ટર / ચેરમેન